

## (૧) વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજો

ઈ-ગવર્નન્સ ખાતુ / ઈ.ડી.પી. ખાતુ

નામ	ઓફિસ ફોન.નં.	રહેઠાણ ફોન નં.	મોબાઇલ નં.
શ્રી કે.એલ.બચાડી કે.ભુનિ.કમિશનર(ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯		
શ્રી રમ્યકુમાર ભડ્ક આસી.ભુનિ.કમિશનર(ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯		
શ્રી યતિન્દ્ર નાયક મેનેજર(ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯, ૩૨૮૮૯૯૮૬		
શ્રી કલ્પેશ સી. કોરડીયા આસી.મેનેજર(ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯, ૩૨૮૮૯૯૮૬		૮૩૭૬૦૧૬૭૮૭
શ્રી અપૂર્વ ભાવેશકુમાર સોલંકી આસી.મેનેજર(ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯, ૩૨૮૮૯૯૮૬		૮૩૨૮૧૮૮૭૩૨
શ્રી નિતીન એમ. અધ્યુ સિસ્ટમ એનાલીસ્ટ	૨૫૩૮૯૮૯૯, ૩૨૮૮૯૯૮૬		૮૩૨૭૦૩૮૮૩૦
શ્રી પી. આર. કાયસ્થ સિસ્ટમ એન્જિનીયર	૨૫૩૮૯૮૯૯/૫૫૧		૮૩૭૭૪૮૨૪૦૩
શ્રી ડી. પી. પંડ્યા જુનીયર સિસ્ટમ એન્જિનીયર	૨૫૩૮૯૮૯૯/૫૫૧		૮૭૧૨૬૭૦૮૮૭
મેઈન સર્વર રૂમ:			
શ્રી હરેશ ડી. સોલંકી મેઈન સર્વર ઓપરેટર	૨૭૪૫૧૭૬૮, ૨૭૪૫૧૮૬૫		
શ્રી પુલકિત સી. સતવારા મેઈન સર્વર ઓપરેટર	૨૭૪૫૧૭૬૮, ૨૭૪૫૧૮૬૫		

## સિવિક સેન્ટરોની યાદી:

### સમય

- કેટેગરી-A : કુલ : ૦૭ સવારે ૮ થી સાંજના ચ કલાક સુધી
- કેટેગરી-B : કુલ : ૦૬ સવારે ૮ થી સાંજના ચ કલાક સુધી
- કેટેગરી-C : કુલ : ૧૮ સવારે ૮ થી સાંજના ૫ કલાક સુધી
- કેટેગરી-D : કુલ : ૧૨ સવારે ૮ થી સાંજના ૫ કલાક સુધી
- કેટેગરી-E : કુલ : ૧૯ સવારે ૮ થી સાંજના ૫ કલાક સુધી

### મધ્ય જોન:

૧. રીલીફ રોડ સિવિક સેન્ટર  
(Category-A)  
ખુનિ.શાળાના મકાનમાં, રૂપમ સિનેમા સામે,  
રીલીફ રોડ, અમદાવાદ.
૨. ગીરધરનગર સિવિક સેન્ટર  
(Category-C)  
ગીરધરનગર વોર્ડ ઓફિસ, કિર્તી એપાર્ટમેન્ટ  
પાછળા, પ્રિતમપુરા ખુનિ.શાળા નં. ૩-૪ પાસે,  
કાનજીનગર ચાર રસ્તા, ગીરધરનગર, અમદાવાદ.
૩. ખાડીયા સિવિક સેન્ટર  
(Category-C)  
જુના આંગરીયા નાકા, મહિપતરામ આશ્રમ સામે,  
રાયપુર દરવાજાની બાજુમાં, ખાડીયા, અમદાવાદ.
૪. દૂષેશ્વર સિવિક સેન્ટર  
(Category-C)  
દૂષેશ્વર સબ જોનલ ઓફિસ, દૂષેશ્વર વોટર વર્ક્સ  
કંપાઉન્ડ, શાહીબાગ, અમદાવાદ.
૫. જમાલપુર સિવિક સેન્ટર  
(Category-D)  
જમાલપુર સબ જોનલ ઓફિસ, જે.પી.સ્ટોર,  
એ.એમ.ટી.એસ. સ્ટાફ કવાર્ટ્સ સામે,  
જમાલપુર, અમદાવાદ.
૬. દરીયાપુર સિવિક સેન્ટર  
(Category-D)  
દરીયાપુર વોર્ડ ઓફિસ, કુટી મશ્જીદ પાસે,  
રૂપારાણીની પોળ પાસે, દરીયાપુર દરવાજા, અમદાવાદ.

૭. શાહપુર સિવિક સેન્ટર  
(Category-C)  
શાહપુર વોર્ડ ઓફિસ, બાપુ સ્મૃતિકૂજ રોડ  
સ્ટોરની બાજુમાં, શાહપુર દરવાજા પાસે, અમદાવાદ.

૮. અસારવા સિવિક સેન્ટર  
(Category-C)  
નરોડા રોડ વોર્ડ ઓફિસ, રેન બસેરા,  
ચમનપુરા સર્કલ,  
ચામુંડા ઓવરબ્રીજ, અમદાવાદ.

૯. દાણાપીઠ સિવિક સેન્ટર  
(Category-A)  
સરદાર પટેલ ભવન,  
અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન,  
દાણાપીઠ, અમદાવાદ.

#### પશ્ચિમ ઝોન:

૧૦. લો-ગાર્ડન સિવિક સેન્ટર  
(Category-A)  
ગુજરાત લો સોસાયટી મેઈન ગેટની સામે,  
એલીસબ્રીજ, અમદાવાદ.

૧૧. ઉસ્માનપુરા સિવિક સેન્ટર  
(Category-A)  
ડો.રમણાભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા ચાર રસ્તા  
આશ્રમ રોડ, અમદાવાદ.

૧૨. વાસણા સિવિક સેન્ટર  
(Category-C)  
વાસણા સ્વીમીંગ પુલ બીલીંગ, ગોદાવરી ફ્લેટની  
સામે, વાસણા, અમદાવાદ.

૧૩. નવા વાડજ સિવિક સેન્ટર  
(Category-D)  
નવા વાડજ સબ ઝોનલ ઓફિસ, પુરખોત્તમ નગર,  
પાર્થ ટાવરની સામે, નવા વાડજ, અમદાવાદ.

૧૪. ધરણીધર સિવિક સેન્ટર  
(Category-C)  
કે.કે શાસ્ત્રી વાંચનાલય, ધરણીધર ટેરાસર સામે, અમદાવાદ.

**૧૫. આંબાવાડી સિવિક સેન્ટર**

(Category-E)

ગાંધીગ્રામ સબ ઝોનલ ઓફિસ,  
હિંમતલાલ પાર્ક પાસે,  
આગાદ સોસાયટી, અમદાવાદ.

**૧૬. સરદાર પટેલ સ્ટેડીયમ સિવિક સેન્ટર**

(Category-D)

સરદાર પટેલ સ્ટેડીયમ વર્ડ ઓફિસ,  
નારણપુરા કોર્સીગ પાસે, પંચશીલ સોસા.પાસે,  
નારણપુરા, અમદાવાદ.

**૧૭. નારણપુરા સિવિક સેન્ટર**

(Category-E)

નારણપુરા વર્ડ ઓફિસ,  
કામેશ્વર મહાદેવ મંદિર પાસે,  
નારણપુરા, અમદાવાદ.

**૧૮. ચાંદખેડા સિવિક સેન્ટર**

(Category-C)

ચાંદખેડા વર્ડ ઓફિસ, જુની ચાંદખેડા  
નગરપાલિકા ઓફિસ, ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે,  
ઈનસાઈડ ચાંદખેડા ગામ, અમદાવાદ.

**૧૯. સાબરમતી સિવિક સેન્ટર**

(Category-D)

સાબરમતી સબ ઝોનલ ઓફિસ,  
ટોરેન્ટ પાવર સ્ટેશન સામે,  
સાબરમતી, અમદાવાદ.

**૨૦. રાણીપ સિવિક સેન્ટર**

(Category-C)

રાણીપ વર્ડ ઓફિસ,  
જૂનું નગરપાલિકા બીટીગ,  
મહેશ પાર્ટી પ્લોટ સામે, અમદાવાદ.

**૨૧. કાળી સિવિક સેન્ટર**

(Category-E)

કાળી વર્ડ ઓફિસ, કાળીગામ,  
પોર્ટ ડિવીજનાગ, અમદાવાદ.

## પૂર્વ ઝોન:

૨૨. વિરાટનગર ટેક્સ કલેક્શન સેન્ટર  
(Category-B)  
હરુભાઈ મહેતા ભવન,  
વિરાટનગર ચાર રસ્તા,  
બાપુનગર, અમદાવાદ.
૨૩. રાજપુર સિવિક સેન્ટર  
(Category-D)  
રાજપુર સબ ઝોનલ ઓફિસ,  
ચક્કાયા મહાદેવ પાસે, બળીયાકાક રોડ,  
રાજપુર, અમદાવાદ.
૨૪. મહાવીરનગર સિવિક સેન્ટર  
(Category-D)  
મહાવીરનગર વર્ડ ઓફિસ,  
ઈન્સાઈડ જુના એ.એમ.ટી.એસ.ટેપો,  
એકતા એપાર્ટમેન્ટ સામે, હાટકેશ્વર,  
સી.ટી.એમ.રોડ, અમદાવાદ.
૨૫. ગોમતીપુર સિવિક સેન્ટર  
(Category-E)  
ગોમતીપુર વર્ડ ઓફિસ,  
ગોમતીપુર રેફરલ હોસ્પિટલ પાસે,  
ખુનિસિપલ બાલ ભવન,  
ગોમતીપુર દરવાજા સામે, અમદાવાદ.
૨૬. અર્બુદાનગર સિવિક સેન્ટર  
(Category-D)  
કવિ રમણલાલ વસંતલાલ દેસાઈ લાયબ્રેરી ભવન,  
કિઞ્ચાપાઈ ટયુબવેલની બાજુમાં,  
સુખનન ગાઈન પાસે, હિન્ડુસ્તાન માર્બલ રોડ,  
નિકોલ, અમદાવાદ.
૨૭. અમરાઈવાડી સિવિક સેન્ટર  
(Category-D)  
અમરાઈવાડી સબ ઝોનલ ઓફિસ,  
મથુર માસ્તર ચાર રસ્તા પાસે, ૧૩૨ ફુટ રીગ રોડ,  
અમરાઈવાડી, અમદાવાદ.

૨૮. વસ્ત્રાલ સિવિક સેન્ટર  
**(Category-E)**  
 વસ્ત્રાલ વર્ડ ઓફિસ,  
 અજય ટેનામેન્ટ વિભાગ-૫ ની બાજુમાં,  
 ગંઠ નં.૩, આર.ટી.ઓ. ઓફિસ સામે,  
 નાની કેનાલ પાસે, વસ્ત્રાલ રોડ,  
 મહાદેવનગર, અમદાવાદ.
૨૯. ઓફવ સિવિક સેન્ટર  
**(Category-C)**  
 ઓફવ વર્ડ ઓફિસ, રબારી વસાહત પાસે,  
 ઓફવ ફાયર સ્ટેશનની બાજુમાં,  
 ઓફવ, અમદાવાદ.
૩૦. નિકોલ સિવિક સેન્ટર  
**(Category-E)**  
 બેટી બચાવો ગ્રાઉન્ડ સામે,  
 નિકોલ, અમદાવાદ.
૩૧. મણીનગર સિવિક સેન્ટર  
**(Category-A)**  
 દક્ષિણ જોન જોનલ ઓફિસ,  
 મણીનગર ફાયર સ્ટેશનની સામે, રામભાગ,  
 મણીનગર, અમદાવાદ.
૩૨. ઈસનપુર સિવિક સેન્ટર  
**(Category-B)**  
 ઈસનપુર વર્ડ ઓફિસ, પાણીની ટાંકી પાસે,  
 પ્રજ હોસ્પિટલની સામે, રામવાડી,  
 ઈસનપુર, અમદાવાદ.
૩૩. ઈન્ડપુરી સિવિક સેન્ટર  
**(Category-B)**  
 ઈન્ડપુરી વર્ડ ઓફિસ, એક્સપ્રેસ હાઇવે પાસે,  
 સી.ટી.એમ. ચાર રસ્તા, અમદાવાદ.
૩૪. કંકરીયા સિવિક સેન્ટર  
**(Category-C)**  
 કંકરીયા વર્ડ ઓફિસ, ભ્યુનિ.સ્કૂલ પાસે,  
 પારસી અગ્નિયારી પાસે, વેદ મંદિર રોડ,

#### દક્ષિણ જોન:

કાંકરીયા, અમદાવાદ.

૩૫. ઘોડાસર સિવિક સેન્ટર  
(Category-E)

ઘોડાસર વોર્ડ ઓફિસ, રાજેશ્વરી સોસાયટી,  
ચંડોળા તળાવ પાસે, ઘોડાસર, અમદાવાદ.

૩૬. વટવા સિવિક સેન્ટર  
(Category-E)

વટવા વોર્ડ ઓફિસ,  
વટવા ગામ, અમદાવાદ.

૩૭. બહેરામપુરા સિવિક સેન્ટર  
(Category-E)

બહેરામપુરા વોર્ડ ઓફિસ,  
ટોરેન્ટ પાવર સબસ્ટેશનની બાજુમાં,  
ખોડીયારનગર ચાર રસ્તા,  
બહેરામપુરા, અમદાવાદ.

૩૮. ખોખરા સિવિક સેન્ટર  
(Category-D)

ખોખરા સર્કલ, રોકડીયા હનુમાનની બાજુમાં,  
ખોખરા, અમદાવાદ.

૩૯. લાંબા સિવિક સેન્ટર  
(Category-E)

લાંબા વોર્ડ ઓફિસ, નારોલ ગામ

ઉત્તર ઝોન:

૪૦. મેમ્કો સિવિક સેન્ટર  
(Category-A)

રાજીવ ગાંધી ભવન, નરોડા રોડ,  
મેમ્કો ચાર રસ્તા પાસે, અમદાવાદ.

૪૧. રખીયાલ સિવિક સેન્ટર  
(Category-B)

વિમલભાઈ ચુનિસિપલ લાયબ્રેરી ભવન,  
રખીયાલ ચાર રસ્તા, અમદાવાદ.

૪૨. નરોડા સિવિક સેન્ટર  
(Category-C)

નરોડા મુઠીયા વોર્ડ ઓફિસ,

નરોડા ગામ, નરોડા, અમદાવાદ.

૪૩. સરદારનગર સિવિક સેન્ટર  
(Category-C)

સરદારનગર લાયબ્રેરી ભવન,  
સરદારનગર પોલીસ સ્ટેશન પાસે,  
સરદારનગર, અમદાવાદ.

૪૪. સરસપુર સિવિક સેન્ટર  
(Category-C)

સરસપુર બાલ ભવન, કે.કે.આઈ.હોસ્પિટલ,  
સરસપુર, અમદાવાદ.

૪૫. કુબેરનગર સિવિક સેન્ટર  
(Category-E)

કુબેરનગર સબ ઝોનલ ઓફિસ,  
સી-વોર્ડ પાણીની ટાંકી પાસે,  
સરદારગ્રામ રેલવે સ્ટેશન સામે,  
અમદાવાદ.

૪૬. નોબલનગર સિવિક સેન્ટર  
(Category-C)

નોબલનગર વોર્ડ ઓફિસ,  
EWS ક્વાટર્સની બાજુમાં,  
ભગવતી ફલોરમીલ પાસે,  
નરોડા પોલીસ સ્ટેશન સામે,  
નરોડા, અમદાવાદ.

૪૭. ઈન્ડીયા કોલોની સિવિક સેન્ટર  
(Category-E)

ઇન્ડીયા કોલોની વોર્ડ ઓફિસ,  
પોટલીયા અર્બન હેલ્પ સેન્ટર કંપાઉન્ડ,  
ચંદ્રપ્રસાદ દેસાઈ હોલ સામે, બાપુનગર, અમદાવાદ.

૪૮. બાપુનગર સિવિક સેન્ટર  
(Category-D)

અર્બન હેલ્પ સેન્ટરની બાજુમાં, મરધા ફાર્મ રોડ,  
વિરાટનગર ચાર રેસ્તા પાસે,  
બાપુનગર, અમદાવાદ.

૪૯. ઠક્કરબાપાનગર સિવિક સેન્ટર  
(Category-E)

ઠક્કરબાપાનગર વોર્ડ ઓફિસ

## નવા પણ્યિમ ઝોન:

૫૦. બોડકટેવ સિવિક સેન્ટર  
(Category-A)  
અતિથિ ડાયનીગ હોલ પાસે,  
દીપ ટાવર પાસે,  
ઇનસાઈડ શ્રદ્ધા પેટ્રોલ પંપ,  
બોડકટેવ, અમદાવાદ.
૫૧. વેજલપુર સિવિક સેન્ટર  
(Category-C)  
વેજલપુર વોર્ડ ઓફિસ,  
જલતરંગ પોલીસ સ્ટેશન સામે,  
અમદાવાદ.
૫૨. ચાંદલોડીયા સિવિક સેન્ટર  
(Category-B)  
ચાંદલોડીયા પ્રાયમરી સ્કૂલ,  
ચાંદલોડીયા, અમદાવાદ.
૫૩. મેમનગર સિવિક સેન્ટર  
(Category-C)  
બોડકટેવ વોર્ડ ઓફિસ,  
જૂની નગરપાલિકા ઓફિસ,  
માનવ મંદિર પાસે, મેમનગર ગામ,  
અમદાવાદ.
૫૪. વસ્ત્રાપુર સિવિક સેન્ટર  
(Category-C)  
અ.ભુ.કો. ટેક્ષ ઓફિસ,  
જૂના ઓક્કરોય નાકા પાસે,  
વસ્ત્રાપુર તળાવ સામે,  
વસ્ત્રાપુર, અમદાવાદ.
૫૫. સરખેજ સિવિક સેન્ટર  
(Category-E)  
સરખેજ વોર્ડ ઓફિસ,  
જૂની નગર પાલિકા ઓફિસ,  
પાણીની ટાંકી પાસે, સરખેજ ગામ,  
અમદાવાદ.

૫૬. ઘાટલોડીયા સિવિક સેન્ટર

(Category-B)

ઘાટલોડીયા વોર્ડ ઓફિસ,  
ચાશકય બ્રીજ નીચે,  
પ્રભાત ચોક પાસે,  
ઘાટલોડીયા, અમદાવાદ.

૫૭. જોધપુર સિવિક સેન્ટર

(Category-D)

જોધપુર વોર્ડ ઓફિસ,  
જૂની નગર પાલિકા ઓફિસ,  
રામજી મંદિર પાસે,  
જોધપુર ગામ, અમદાવાદ.

૫૮. ગોતા સિવિક સેન્ટર

(Category-E)

ગોતા વોર્ડ ઓફિસ, સાયન્સ સીટી રોડ,  
અમદાવાદ.

૫૯. થલતેજ સિવિક સેન્ટર

(Category-E)

આઈના કોમ્પ્લેક્સ પાસે, કોલંબીયા એશીયા હોસ્પિટલ પાસે,  
થલતેજ, અમદાવાદ.

૬૦. આર.ટી.ઓ. વ્હીકલ ટેક કલેક્શન સેન્ટર

આર.ટી.ઓ.કેમ્પસ, સુભાષ બ્રીજ, અમદાવાદ.

## (૨) અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યો અને ફરજો

ક્રમ	જગાનું નામ / હોદ્દો	અધિકારી / કર્મચારી પાસેથી લેવામાં આવતી કામગીરી
૧	મેનેજર	<ul style="list-style-type: none"> <li>મેનેજર ખાતાના હેડ ગણાશે અને ઈ-ગવર્નન્સ ખાતાનો સંપૂર્ણ ચાર્જ તેમની પાસે રહેશે.</li> <li>કે.બ્યુનિ.કમિ. (ઇ-ગવર્નન્સ)શ્રીની સીધી ટેલિકોમન્ડ હેઠળ ખાતાની સમગ્ર કામગીરીનું સંચાલન, સુપરવીઝન, માર્ગદર્શન અને અંકુશ તેમજ સમયાંતરે બ્યુનિ. કમિ. શ્રી / કે.બ્યુનિ. કમિ.શ્રી / આસી.બ્યુનિ. કમિ.શ્રી દ્વારા સોંપવામાં આવતી ફરજ બજાવવાની રહેશે.</li> </ul>
૨	આસી. મેનેજર-૧  આસી. મેનેજર-૨	<ul style="list-style-type: none"> <li>ખાતાના વહીવટીય તેમજ ટેકનીકલ એડમીનિસ્ટ્રેશનની કામગીરી કરવાની રહેશે.</li> <li>સીટી સીવીક સેન્ટરોનું સંચાલન.</li> <li>ઇ-ગવર્નન્સ ખાતાના તમામ ટેકનીકલ અને એડમીનિસ્ટ્રેટીવ ઈસ્યુઓનું મેનેજમેન્ટ તેમજ એડમીનિસ્ટ્રેટીવ પ્રોસીજરની ટેલિકોમન્ડ રાખી અન્ય ડિપાર્ટમેન્ટ સાથે જરૂરી કોમયુનીક્શન એસ્ટાભ્લીશ કરી જે તે ખાતાના પ્રોબ્લેમ્સ અને તેનું નિરાકરણ કરવા સારુ મેનેજરશી સાથે</li> </ul>

		<p>મેનેજમેન્ટ કરવું.</p> <ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતાની સ્ટેશનરી અને મશીનોની ઈન્વેન્ટરીનું મેનેજમેન્ટ કરવું.</li> </ul>
૪	સીસ્ટમ એનાલીસ્ટ	<ul style="list-style-type: none"> <li>ખુનિ. કોપોરિશન દ્વારા નવી સિસ્ટમના ડેવલપમેન્ટની સિસ્ટમ સ્ટ્રી, સિસ્ટમ ડીજાઇન તેમજ તેઓ ફ્લોડો ડીજાઇનની કામગીરી અને તે અનુસાર જે તે પ્રોગ્રામરશ્રીઓ મારફતે જરૂરી પ્રોગ્રામ ડેવલપ કરાવી સિસ્ટીમ સંપૂર્ણપણે અમલીકૃત કરાવવી.</li> <li>સિસ્ટમ એનાલીસ્ટશ્રીઓ ડીજાઇન ઉપરાંત સીસ્ટીમ મેઇન્ટેનન્સની કામગીરી, પ્રોગ્રામરશ્રીની કામગીરીનું મુલ્યાંકન તેમજ જરૂર જ્ઞાય તાં તેઓએ તેમની કામગીરીમાં માર્ગદર્શન આપવું.</li> <li>સર્વરરૂમ ખાતે વેબસાઈટ અધ્યતન રાખવી, જે તે ખાતાની સૂચના મુજબ સોફ્ટવેર અધ્યતન/અપડેટ કરાવવું, મેલ સર્વર ડેટાભેઝ બેકઅપ વગેરે કામગીરીની દેખરેખ રાખવી.</li> </ul>
૫	સીસ્ટમ એન્જનીયર	<ul style="list-style-type: none"> <li>કોમ્પ્યુટર મશીનોનું રીપોર્ટિંગ, મેઇન્ટેનન્સ, કોમ્પ્યુટર સિસ્ટમોનું ઈન્સ્ટોલેશન, સોફ્ટવેર ઈન્સ્ટોલેશન સીસ્ટીમ શીફ્ટાંગ તેમજ જુ. સીસ્ટીમ એન્જનીયરશ્રીની કામગીરીમાં માર્ગદર્શન કરવાનું રહેશે.</li> <li>તમામ પ્રકારના હાર્ડવેર, તેના ઈસ્યુ, વપરાશ, મેઇન્ટેનન્સ વગેરેની કામગીરી કરવી.</li> <li>જરૂરી મશીનો ખરીદવાની એડમિનિસ્ટ્રેટીવ પ્રોચેઝર જેવી કે ટેન્ડર ફ્લોટાંગ, ટેન્ડર એનાલીસીસ અને ટેન્ડરનું પૃથ્વકરણ કરી જરૂરી કમ્પેરેટીવ (ટેકનીકલ કોમેન્ટ સાથે) ખાતાના અધિકારીશ્રીને સબ્મિટ કરવું.</li> </ul>
૬	જુની. સીસ્ટમ એન્જનીયર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા ઈન્સ્ટોલ કરાયેલ અને અમદાવાદ ખુનિ. કોપોરિશન દ્વારા ખરીદાયેલા કોમ્પ્યુટરોનું જરૂરી રીપોર્ટિંગ કરવું.</li> <li>તમામ પ્રકારના હાર્ડવેર, તેના ઈસ્યુ, વપરાશ, મેઇન્ટેનન્સ વગેરેની કામગીરી કરવી.</li> <li>સીસ્ટમ એન્જનીયરશ્રી તથા ખાતાના અધિકારીશ્રીઓશ્રી દ્વારા સોપાયેલ કામગીરી કરવી.</li> </ul>
૮	જુની. પ્રોગ્રામર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતાના સીસ્ટમ એનાલીસ્ટશ્રી તથા આસી.મેનેજરશ્રી દ્વારા અપાયેલ પ્રોગ્રામીંગની કામગીરી કરવી</li> <li>સીસ્ટમનું જરૂરી મેઇન્ટેનન્સ કરી જે તે જરૂરી રીપોર્ટ સીસ્ટીમ એનાલીસ્ટશ્રીના માર્ગદર્શન હેઠળ બનાવવા.</li> <li>જરૂરી પ્રોસેક્ટાંગની સૂચનાઓ કોમ્પ્યુટર ઓપરેટરશ્રીઓને આપવી.</li> <li>ટેક્ષ વિભાગની ઓનલાઈન રીકવરી સીસ્ટમમાં ટેક્ષ વિભાગની માંગણી અનુસાર જરૂરી પ્રોગ્રામીંગ કરી રીપોર્ટ જનરેશન, ડેટા એન્ટ્રી મોડ્યુલ, ચેકલીસ્ટ પ્રિન્ટાંગ પ્રોવીઝન કીએટ કરવા.</li> </ul>
૧૦	કોમ્પ્યુટર ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતામાં ચાલતી તમામ સીસ્ટમોનું પ્રોસેસીંગ વર્ક જુની. પ્રોગ્રામરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવી.</li> <li>જુદી જુદી સીસ્ટમોના નીકળતા રીપોર્ટસનું જરૂરી પ્રિન્ટાંગ કરી જે તે ડીપાર્ટમેન્ટને આ અંગેની જાણ કરવી.</li> <li>રોજ રોજ જે તે સીસ્ટીમોના ડેટાનો બેક અપ લેવો અને તેને મેઇન્ટેનન્સ કરવો.</li> <li>ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા સોપાયેલ કામગીરી કરવી.</li> </ul>
૧૨	ડી.ટી.પી. ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>ખુનિ. કમિશનરશ્રી અને ડી. ખુનિ. કમિશનરશ્રીઓના ઓફીસ વર્કના જરૂરી ડૉક્યુમેન્ટ્સને કોમ્પ્યુટરમાં એન્ટર કરવા</li> <li>ખુનિ. કોપોરિશનના જુદા જુદા પ્રોજેક્ટનું પ્રોજેક્શન કોમ્પ્યુટર દ્વારા જરૂરી માર્ગદર્શન પ્રમાણે કરવું</li> <li>ગુજરાતી કે અંગેજમાં જરૂર હોય તે પ્રમાણે અધિકારીશ્રીની સૂચના મુજબ કામગીરી કરવી.</li> </ul>
૧૩	જુની. કોમ્પ્યુટર ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>પે-રોલ સીસ્ટમના ડેટાના પ્રોગ્રામના રન કરવા તથા પ્રોસેસીંગ જેવા કે ચેકલીસ્ટ, અપટેટાંગ, વેલિડિશન, કરેક્શન વિગેરે કરવા તથા તેનું પ્રિન્ટાંગ કરવું, ટમિનિલ / પ્રિન્ટર</li> </ul>

		<p>સેટીંગ તથા મેઈન્ટેનન્સ</p> <ul style="list-style-type: none"> <li>જુદી જુદી સીસ્ટમો જેવી કે વીકલ ટેક્સમાં બીલ, ડીમાન્ડ, બીલ ઈસ્યુ રજસ્ટર, સમરી તૈયાર કરી પ્રિન્ટ કરવા. વોટર મીટર સીસ્ટમમાં બીલ, ડીમાન્ડ, રીટીંગ રજસ્ટર પ્રોસેસીંગ કરી પ્રિન્ટ કરવા અને પ્રોપર્ટી ટેક્સ સીસ્ટમમાં બીલ, ડીમાન્ડ, ઈસ્યુ રજસ્ટર, રેકવીજિશન ફોર્મ, સ્લીપ ડીમાન્ડ સમરી વગેરેનું પ્રોસેસીંગ કરી પ્રિન્ટ કરવા.</li> <li>જુદા જુદા ખાતામાંથી આવત પ્રિન્ટીંગ જેવા કે પેન્શન, બજેટ, પી.એફના પ્રિન્ટીંગ જરૂરીયાત અને સૂચના મુજબ કાઢી આપવા તથા સક્ષમ અધિકારીશ્રી તરફથી સોંપાતી કામગીરી કરવી</li> <li>સર્વર અપલોડીંગ તેમજ નિયમિત રીપોર્ટ જનરેશન, સમરી રીપોર્ટ જનરેશન</li> </ul>
૧૪	ટેટા એન્ટ્રી ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતામાં ચાલતી વિવિધ સીસ્ટમો માટે જરૂરી ટેટા એન્ટ્રી જે તે પ્રોગ્રામ અનુસાર કરવી</li> <li>આ અંગે જરૂરી ટેટા એકત્ર કરી સુપરવાઈઝરને આપવો</li> </ul>
૧૫	સીનીયર કલાર્ક	<ul style="list-style-type: none"> <li>વહીવટી વિભાગનું સંચાલન, કામગીરી સરળતાથી ચાલે તે માટે તથા કર્મચારીઓની હાજરી પત્રક પરથી તેઓની સી.એલ., ઈ.એલ., મેડીકલ તથા અન્ય રજાઓ ભરવાની કામગીરી કરવી.</li> <li>જૂના ઓડીટ વાંધાઓના નિકાલ કરવાની કામગીરી કરવી.</li> <li>મેનેજરશ્રી અને આસી.મેનેજરશ્રી તરફથી સોંપાતી તમામ કામગીરી કરવી.</li> <li>ઈમ્પ્રેશ કેશ તથા તેના હિસાબની જાળવણી કરવી.</li> <li>ઈ-ગવર્નન્સ ખાતામાં આવતા બીલોના પેમેન્ટ અંગેના ચેકો માટે પાર્ટીને ચેક ચૂકવવાની તથા તેમની પાસેથી રીસીપ્ટ મેળવી તે અંગેના પેમેન્ટની કામગીરી કરવી તથા ઓફિસર્સને માહિતી આપવી.</li> <li>કર્મચારીઓનું હાજરી પત્રક નિયમિત ચકાસવું.</li> </ul>
૧૬	જુની. કલાર્ક	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતુ તથા ઈ-ગવર્નન્સ ખાતાના પત્રો તથા ફાઈલોના ઈનવર્ડ તથા આઉટવર્ડ અંગેની તમામ કામગીરી કરવી.</li> <li>મેનેજરશ્રી તથા આસી.મેનેજરશ્રી અને ખાતાના અધિકારીશ્રીઓ જે કામગીરી બતાવે તે કામગીરી કરવી.</li> <li>પે-રોલ ના જરૂરી પત્રકો મેળવી રી-પ્રિન્ટ અંગેની કામગીરી કરવી.</li> <li>ઈ-ગવર્નન્સ ખાતાના બીલ કલાર્કની તમામ કામગીરી, સર્વિસ બુકોની નિભાવણી કરવી.</li> <li>વહીવટી કામગીરી કરવી.</li> <li>સીની. કલાર્કશ્રીની કામગીરીમાં મદદ કરવી તથા અન્ય કલાર્કની ગેરહાજરીમાં તેમની કામગીરી કરવી.</li> </ul>
૧૭	પટાવાળા	<ul style="list-style-type: none"> <li>ખાતાની ટપાલ લઈ જવી તથા લાવવી</li> <li>અન્ય વહીવટી કામગીરીમાં સેવા આપવી</li> </ul>
૧૮	મજુર	<ul style="list-style-type: none"> <li>કોમ્પ્યુટર સ્ટેશનરી ગોડાઉનમાંથી લાવી પ્રિન્ટીંગ માટે પ્રિન્ટર રૂમમાં આપવી</li> <li>પ્રિન્ટ થયલ સ્ટેશનરી જે તે વિભાગમાં પહોંચતી કરવી</li> </ul>

(૩) દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યવાહી

(એ.) જૂ.કલાર્ક ફાઈલ કે પેપર્સ તૈયાર કરી સીની.કલાર્ક સમક્ષ મૂકે છે.

(બી.) સીની.કલાર્ક .કે હેડ કલાર્ક ફાઈલ કે પેપર્સ તપાસી આસી.મેનેજરશ્રી સમક્ષ મૂકે છે.

- (સી.) આસી.મેનેજર ફાઈલ કે પેપર્સ તપાસી મેનેજરશ્રી સમક્ષ મૂકે છે.
- (ડી.) મેનેજરશ્રી ફાઈલ કે પેપર્સ તપાસી આસી.ભુનિ.કમિ.શ્રી સમક્ષ મૂકે છે.
- (ઇ.) આસી.ભુનિ.કમિ.શ્રી ફાઈલ કે પેપર્સ તપાસી વિભાગના ડે.ભુનિ.કમિ.શ્રી તરફ મોકલે છે.
- (એફ.) ડે.ભુનિ.કમિશનરશ્રી ફાઈલ કે પેપર્સ તપાસી ખુ.કમિશનરશ્રી તરફ મંજુરી અર્થે મોકલે છે.
- (જ.) આગણ ઉપર જરૂર હોય તો સ્ટે.કમિટીની કે સ્ટે.કમિટી મારફતે ખુ.કોર્પો.ની મંજુરી કે નિર્ણય મેળવવામાં આવે છે.
- (૪) પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો જે-તે ખાતાની જરૂરીયાત મુજબ કોમ્પ્યુટરાઈઝેશનની કામગીરી કરાવવી.
- (૫) પોતના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ ખુનિસિપલ કોર્પોરેશનના નિતી નિયમો તથા બોમ્બે ગ્રોવિન્સીયલ ખુ.કોર્પો.એક્ટ -૧૯૪૮ ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.
- (૬) પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક આ વિભાગમાં અગત્યના કોઈ દસ્તાવેજો રાખવાના હોતા નથી.
- (૭) તેની નીતિ અથવા તેની અમલીકરણના ઘડતરના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિધમાન કોઈ ગોઠવણની વિગતો આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૮) તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેંક્સ લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેંક્સની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૯) તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા

મ્યુનિ. સેવાઓને લગતા અગત્યના ટેલીફોન નંબર.

અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ

(૧૦) તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર

અનુ.નં.	હોદ્દો	ગ્રેડ	પે-બેન્ડ
૧	મેનેજર	૧૫૬૦૦-૩૮૧૦૦	૬૬૦૦
૨	આસી.મેનેજર-૧, ૨	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૩	સિસ્ટમ એનાલીસ્ટ	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૪	સિસ્ટમ એન્જિનીયર	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૫	જુની. પ્રોગ્રામર	૮૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૬	જુની. સિસ્ટમ એન્જિનીયર	૮૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૭	કોમ્પ્યુટર ઓપરેટર	૮૩૦૦-૩૪૮૦૦	૪૨૦૦
૮	સિની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦	૪૨૦૦
૯	ડી.ટી.પી.ઓપરેટર/સીનીયર કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦	૪૨૦૦
૧૦	ડેટા એન્ટ્રી ઓપરેટર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૧૧	જુની.કોમ્પ્યુટર ઓપરેટર	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૧૨	જુની.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૧૩	પટાવાળા	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૧૪	મજૂર	૪૪૪૦-૭૪૪૦	૧૬૫૦

(૧૧) તમામ યોજનાઓ સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર

ઈ-ગવર્નન્સ ખાતુ - કોમ્પ્યુટર કોડ - ૧૧૪

સને ૨૦૧૫-૧૬ ના બજેટમાં ઈ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટની અંદાજેલ ખર્ચ

અનુ.નં.	વિગત	અંદાજેલ ખર્ચ (રૂ. લાખમાં)
૧	પગાર ખર્ચ	૬૪૭.૩૩
૨	યુનિફોર્મ	૦.૩૦
૩	ટેલીફોન તથા ટ્રાન્કડોલ (ઓફિસ)	૨૬૦.૭૦
૪	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૦.૦૬
૫	મેઝબરશીપ ફી	૦.૧૦
૬	સ્ટેશનરી	૮.૦૦
૭	કોમ્પ્યુટર સ્ટેશનરી	૧૨.૦૦
૮	પ્રિન્ટિંગ	૨.૦૦
૯	ઝેરોક્ષ	૦.૨૫
૧૦	પુસ્તકો, અખબારો, સામયિકો, રમકડા	૦.૧૦
૧૧	સ્ટાફ ટ્રેનિંગ	૧૧.૦૦
૧૨	અન્ય ખર્ચ	૮.૦૦
૧૩	કોમ્પ્યુટર	૧૮૪.૦૦
૧૪	ટેબલ તથા ખુરશી, બાંકડા, બેચ	૪.૦૦
૧૫	સીસીટીવી	૬૦.૦૦
૧૬	વર્કચાર્જ કર્મચારીના પગાર	૪૦૮.૦૦
૧૭	ફોન્પી	૦.૧૦
૧૮	સોફ્ટવેર મરામત અને નિભાવ	૩૦૦.૦૦
	કુલ	૧૮૦૬.૮૪

**સને ૨૦૧૫-૧૬ ના બજેટમાં અંદાજેલ વિકાસના કામો ખર્ચ**

અનુ.નં.	વિકાસના કામો	(રૂ. લાખમાં)
૧	કોમ્પ્યુટર્સ	૧૩૭૦.૦૦
૨	સંદેશા વ્યવહારનાં સાધનો	૨૫.૦૦
૩	પેઇઝંગ એન્ડ મોબાઈલ	૧૫૦.૦૦
	કુલ	૧૫૪૫.૦૦

(૧૨) ફાળવેલ રકમ અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૩) આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૪) ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો

જે માહિતી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે તેની વિગત વિભાગના કાર્યક્ષેત્રમાં જે તે કામગીરીમાં દર્શાવેલ છે.

(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો

આ વિભાગમાં કોઈ ગ્રંથાલય નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓના હોદાઓ અને બીજી વિગતો

અંશ	હોદ્દો	ફરજનો સમય	ફરજનું સ્થળ	ફોન નંબર
૧	આસી. મેનેજર જાહેર માહિતી અધિકારી	સવારે ૧૦.૩૦ થી સાંજના ફ. ૧૦	સરદાર પટેલ ભવન દાશાપીઠ, અમદાવાદ	૨૫૩૮૯૮૯૯
૨	મેનેજર અપીલ અધિકારી	સવારે ૧૦.૩૦ થી સાંજના ફ. ૧૦	સરદાર પટેલ ભવન દાશાપીઠ, અમદાવાદ	૨૫૩૮૯૮૯૯


## (૧૭) દરાવવામાં આવે તેવી બીજી માહિતી

### ઈ - ગવર્નર્સ

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પાયાની જરૂરિયાતો જેવી કે પાણી, ગટર, રસ્તા અંગેની ફરિયાદો, જન્મ-મરણની નોંધણી, બિલ્ડિંગ પ્લાન એપ્રુવલ, ગુમાસ્તાધારા હેઠળ શોખ્સ અને એસ્ટાબ્લિશમેન્ટની નોંધણી તેમજ રિન્યુઆલ વગેરે સવલતો પૂરી પાડવામાં આવે છે. સદર જરૂરિયાતો ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરો અને અન્ય નાણાંકીય સ્ત્રોત દ્વારા પૂરી પાડવામાં આવે છે. શહેરીજનોની સુવિધા અને સગવડતા વધારવાની સાથે સાથે કામગીરીમાં પારદર્શકતા આવે એ પણ ખૂબ જ જરૂરી છે. આ અંગે ઈન્ફર્મેશન ટેકનોલોજીનો વ્યવહાર ઉપયોગ ખૂબ જ મહત્વનો બની રહે છે. અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારશ્રીની સંસ્થા ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિ.ના સહયોગથી ઈ-ગવર્નર્સ પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેના સંદર્ભે પશ્ચિમ ઝોનમાં ૧૨, પૂર્વ ઝોનમાં ૮, મધ્ય ઝોનમાં ૮, દક્ષિણ ઝોનમાં ૮, ઉત્તર ઝોનમાં ૧૦, નવા પશ્ચિમ ઝોનમાં ૮ એમ પણ સિવિક સેન્ટર તેમજ દાણાપીઠ, મેમનગર, આર.ટી.ઓ અને વિરાટનગર ખાતે એક-એક એમ કુલ ચાર ટેક્સ કલેક્શન સેન્ટર સહિત કુલ ૫૮ સેન્ટર્સ કાર્યરત કરવામાં આવેલ છે. સદર તમામ સિવિક સેન્ટરને લીજ લાઈન વડે સાંકળી લેવામાં આવેલ છે. જેથી કોઈ પણ ઝોનનો કરદાતા કોઈ પણ સેન્ટર ખાતે નાણાં ભરી શકે તેમજ ફરિયાદ નોંધાવી શકે છે. નાગરિકોને સિવિક સેન્ટર પરથી નીચે જણાવેલ સવલતો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં આ સેવાનો ફલક તમામ વોર્ડ સુધી વધારી કોમ્પ્યુટર મારફત ફરિયાદો સ્વીકારવામાં આવે છે.

૧. પ્રોપર્ટી ટેક્સ કલેક્શન
૨. વ્યવસાય વેરા કલેક્શન
૩. વ્હીકલ ટેક્સ કલેક્શન
૪. બિલ્ડિંગ પ્લાન એપ્રુવલ
૫. જન્મ-મરણ નોંધણીની નકલની પ્રાપ્તિ
૬. ગુમાસ્તાધારા સટીફીકેટ
૭. હેલ્થ લાયસન્સ
૮. હોકર્સ લાયસન્સ
૯. રાઈટ ટુ ઈન્ફોર્મેશન અરજી સ્વીકાર
૧૦. હોલ બુકીંગ
૧૧. ટેક્સ ખાતાની અરજીનો સ્વીકાર
૧૨. ટી.ડી.ઓ. ફી
૧૩. AMTS સીટી બસ પાસ
૧૪. સ્વીમીગપૂલ ફી

વધુમાં ઉપરોક્ત તમામ સવલતો સુરક્ષિત વેબસાઈટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) દ્વારા નાગરિકોને ઘેર બેઠાં પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવેલું છે.



## પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, તા. ..... દરમ્યાન મારા વહીવટી કાર્યક્ષેત્ર હેઠળની આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો “પ્રોએક્ટિવ ડિસ્કલોઝર” (PAD) તૈયાર કરવામાં આવી છે. તેનું અમારા દ્વારા ઈન્સપેક્શન-કમ-ઓર્ડિટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગાર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

મેનેજર (ઈ-ગર્વનન્સ)